

Date: 05.02.2026

To,
Gen. Manager (DCS)
BSE Limited.
P J Towers, Dalal Street,
Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 523650 M/S. YASH INNOVENTURES LIMITED (FORMERLY KNOWN AS REDEX PROTECH LIMITED)

Dear Sir,

Please find enclosed herewith copy of **Advertisement given in newspaper of unaudited financial results for the quarter ended on 31ST December 2025** in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on **Wednesday, 04th February, 2026.**

You are requested to take the same on your record.

Thanking You.

Yours Sincerely,

**FOR, YASH INNOVENTURES LIMITED
(FORMERLY KNOWN AS REDEX PROTECH LIMITED)**

Mr. GNANESH RAJENDRABHAI BHAGAT
Managing Director
(DIN: 00115076)



Address

Parshwanath Business Park, Corporate House
No.3, Opp. Prahladnagar Auda Garden,
Anandnagar Road, Ahmedabad 380015

Website

www.yashinnoventures.com

Phone

+91 79 2970 0120

Cognizant Q4 net profit rises 19%, to hire more freshers this year

Nasdaq-listed Cognizant on Wednesday reported a 19 per cent rise in net profit to \$648 million in the fourth quarter of calendar year 2025 (CY25). Revenue rose 4.9 per cent to \$5.3 billion while on a constant currency basis, which discounts the impact of currency fluctuations, growth was 3.8 per cent.

inflation, and that will make the spends in favour of the cost takeout, but if those go down, the spends will be in the newer area,” Cognizant Chief Executive Officer (CEO) Ravi Kumar said.

And, even while technology spends remain muted or get redirected, financial services spends in the US – the largest market – are picking up. For the three months ending December 31, financial services vertical was up 9.3 per cent on constant currency. North America, which contributes three-fourths to the top line, was up 4.2 per cent.

The growth numbers were way better than most of its Indian counterparts. Only HCLTech fared better than Cognizant with a constant currency growth of 4.8 per cent and reported growth of 7.4 per cent.

Cognizant, which follows the January-December calendar year, expects to grow at 4-6.5 per cent in the full year of 2026 after beating its own guidance in 2025. For 2025, it grew at 6.4 per cent on constant currency, slightly above its estimates of 6-6.3 per cent.

“The macro continues to be uncertain with geopolitics and

Winning large deals, worth \$100 million and above, has been a key priority for Kumar in this uncertain macroeconomic environment. In 2025, Cognizant won 28 large deals with total contract value (TCV) growth up almost 50 per cent compared to 2024. Total bookings for the fourth quarter was \$28.4 billion. Operating margins jumped

120 basis points (bps) to 16 per cent sequentially. “In 2025, we outperformed the high end of our guidance ranges, combining top-tier revenue growth with 50 bps of expanded adjusted operating margin and 11 per cent adjusted EPS (earnings per share) growth,” Chief Financial Officer (CFO) Jatin Dalal said.

The company, whose majority of employees are based in India, saw its tech services attrition climb down to 13.9 per cent from 14.5 per cent, sequentially. As of December, it had 351,600 employees and net hiring during the year was 14,800 people.

Going ahead, Cognizant will continue to hire at the bottom end of the pyramid, which refers to new engineering graduates. It hired about 20,000 such graduates last year, of which 16,000 are already working on live projects.

The target is to hire about 25,000 this year, Dalal added.

ElevenLabs raises \$500 million in Series D, valuation jumps to \$11 bn

Voice artificial intelligence startup ElevenLabs has raised \$500 million in a Series D funding round led by Sequoia Capital, with Andrew Reed joining the company's board. The funding values ElevenLabs at \$11 billion, more than tripling its valuation from a year ago, and takes its total funding to \$781 million across five rounds since its founding in 2022.

ElevenLabs began by developing human-like AI text-to-speech models. Since then, the company has expanded beyond voice, advancing research across speech-to-text, sound effects, dubbing, music



and conversational AI.

The company said existing investors Andreessen Horowitz (a16z) quadrupled down on their investment, while ICONIQ tripled down, both with significant super pro-rata participation. New investors Lightspeed Venture Partners, Evantic Capital and BOND also joined the round. Existing backers BroadLight, NFDG and Valor Capital continue to support the company, with additional investor participation expected to be disclosed later in February.

Founded in 2022,

for product experiences that we believe will redefine benchmarks,” he added.

The company has also been expanding its presence in India. In January, ElevenLabs appointed Karthik Rajaram as general manager and country head for India. It currently works with Indian firms such as Meesho and Pocket FM.

In an earlier statement, ElevenLabs said India has become its largest global market. The company is expanding its local team to meet demand, investing in AI audio research, and supporting local initiatives in the country.

“This funding helps us go beyond voice alone to transform how we interact with technology altogether. We plan to expand our creative offering — helping creators combine our best-in-class audio with video — and build agents that can talk, type and take action,” said Mati Staniszewski, co-founder of ElevenLabs.

Yash Innoventures Limited

(CIN: L45100GJ1991PLC016557)

(Formerly known as Redex Protech Limited)

Registered Office: 1 Floor, Corporate House No.3, Parshwanath Business Park, Behind Prahladnagar Garden, S G Highway, Ahmedabad-380014, Gujarat, India.

EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.12.2025 (Rupees in Lacs)

Sr. No.	Particulars	Quarter ended 31-12-2025	Quarter ended 30-09-2025	Quarter ended 31-12-2024	Nine Months ended		Year ended 31-Mar-25
		31-12-2025	30-09-2025	31-12-2024	31-12-2025	31-12-2024	31-Mar-25
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1	Total income from operations	10.62	40.64	-17.32	149.97	44.51	49.12
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	-39.97	-173.94	-71.71	-250.20	-169.49	-316.50
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	-39.97	-173.94	-71.71	361.90	-169.49	-316.50
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	-45.32	-215.50	-75.80	263.59	-190.76	-446.21
5	Total Comprehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	-45.32	106.63	-75.80	585.72	-190.76	-446.21
6	Equity Share Capital	1603.00	1603.00	1603.00	1603.00	1603.00	1603.00
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	402.82	402.82	402.82	402.82	402.82	402.82
8	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)						
	Basic :	-0.28	0.67	-0.47	3.65	-1.19	-2.78
	Diluted :	-0.28	0.67	-0.47	3.65	-1.19	-2.78

Notes:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com).
- The result of the Quarter ended on 31st December, 2025 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 04/02/2026.



BY ORDER OF THE BOARD OF DIRECTORS,
For Yash Innoventures Limited
SD/-

Gnanesh Bhagat
Managing Director
DIN - 00115076

Place: Ahmedabad
Date: 04/02/2026

Headwinds may be turning into tailwinds for foreign inflows: FM Sitharaman

The headwinds may finally be turning into tailwinds for foreign investment flows into India with the announcement of a trade deal between New Delhi and Washington, Union Finance and Corporate Affairs Minister Nirmala Sitharaman said on Wednesday, arguing the country's macroeconomic fundamentals were strong even when investors began pulling out nearly a year ago.

“The fundamental macroeconomic indicators were strong then, strong afterwards, and are strong even now, but then for investment to come in, there's something else. If you take the reaction to the day before yesterday's phone conversation between the two leaders (referring to the phone call between Prime Minister Narendra Modi and US President Donald Trump on February 2), you can see the weathercock. Look at the big funds... also see the environment now having a different air... So I think that change of wind — headwind becoming a tailwind — is

probably happening post the phone call,” she told in an interview at her office in the new Parliament building.

Sitharaman said India would soon undertake another round of Customs clean-up, signalling that the rationalisation in the Budget was not comprehensive yet. The government, she said, had deliberately sequenced the reforms rather than executing them in a single sweep, given the multiple layers of the Customs ecosystem. “Some changes could even be introduced through treasury amendments. But it will happen...the sooner the better,” she said.

The minister also said that consolidation of state-owned banks could proceed at any time without waiting for the recommendations of the proposed high-level committee on banking. “All that has been approved by the Cabinet, could happen any time,” she said.

Acknowledging that the

pace of fiscal consolidation budgeted for FY27 — to reduce the fiscal deficit by 10 basis points to 4.3 per cent of GDP — could have been more aggressive, Sitharaman said the aim was to retain a cushion for uncertainty. “With the global uncertainties being what they are, and having given ?12 lakh in income tax (exemption)... I didn't want (to be) left with no room in case I wanted some flexibility in one thing or the other... Because you don't know what's going to happen globally as many challenges are still active and alive,” she pointed out.

On the debt-to-GDP trajectory, Sitharaman agreed that the 50 basis point reduction for FY27 creates an impression of backloading consolidation, but that was not the intent. “I do not want that burden to be completely pushed to the rear end. If I'm in a position to extinguish more even at the beginning... it's comfortable for me. I will steadily increase it, but not really push it to be back-ended.”

CCI orders antitrust probe against IndiGo for abuse of dominant position

The Competition Commission of India (CCI) has ordered an investigation into the country's largest airline, IndiGo, after finding prima facie evidence that it abused its dominant market position, according to an order issued by the antitrust watchdog on Wednesday. The Commission, following its preliminary inquiry, said the airline appeared to have caused an appreciable adverse effect on competition by restricting its services.

Earlier, on December 18, 2025, the CCI said in a brief statement that it had taken cognizance of information filed against IndiGo in connection with widespread flight disruptions across multiple routes between December 1 and 9.

In its order, the Commission noted that by cancelling thousands of flights, representing a significant proportion of its scheduled capacity, IndiGo had effectively withheld services from the market.

This, it said, created an artificial scarcity and limited consumer access to air travel during a period of peak demand.

dominant enterprise may be viewed as restricting the provision of services under Section 4(2)(b)(i) of the Act,” stated the CCI in its 16-page order.

The Commission said that, given IndiGo's dominant position, consumers were effectively locked in and lacked viable alternatives, a situation that appeared to violate provisions of the Competition Act.

The CCI has directed the office of the director general (DG) to submit an investigation report within 90 days of receiving the order.

The order records IndiGo's submission that the Competition Act does not empower the Commission to examine the adequacy or effectiveness of sectoral regulatory frameworks. The airline argued that “any intervention by the Commission in matters falling within the exclusive remit of the DGCA (Directorate General of Civil Aviation) would amount to an impermissible assumption of jurisdiction”.

IndiGo cancelled more than 4,200 flights between December 1 and 9.

“Such conduct by a The disruption was

A new hand on the wheel at Yes Bank: Vinay Tonse named new MD & CEO

Vinay Muralidhar Tonse (60), who will take over as managing director and chief executive officer of Yes Bank from Prashant Kumar, has his task cut out to catapult the lender into the next phase of its growth trajectory. The bank has seen subdued asset-side expansion in recent quarters, particularly in retail, as it shifted away from traditional products such as home and car loans towards mid-yielding segments.

The appointment is significant as it comes after Japanese financial major Sumitomo Mitsui Banking Corporation (SMBC) picked up a 25 per cent stake in the bank last year.

Tonse, like the present Yes Bank MD and CEO Prashant Kumar, is a former State Bank of India (SBI) banker. He retired from SBI in November 2025 as managing director, heading the bank's retail operations.

“He has all-round experience. Across his career, he has covered almost every major area — corporate banking, markets, international banking and retail — along with leading a key subsidiary of State Bank of India (SBI). He is an experienced professional with a strong track record of performance and a people-oriented leadership style, making him a very good choice overall,” said a senior banker on Tonse's appointment as Yes Bank MD and CEO.

Sources aware of the development said there were three candidates in the reckoning for the MD and CEO position, of which two were from the private sector, but Yes Bank's board decided to go with Tonse as its lead choice.

Tonse joined SBI as a probationary officer in 1988 and spent over 30 years with the country's largest lender, working across multiple locations in India and overseas. During his tenure, he handled a wide range of assignments spanning corporate credit, treasury, retail and international banking.

Kumar assumed charge at Yes Bank in March 2020 during the bank's reconstruction phase. His term was extended by six months to April 6 this year so that the new shareholder, SMBC, could have a say on future leadership. Kumar is widely credited with steadying the ship following the crisis that led to the bank's reconstruction with new ownership.

Tonse has significant international exposure, having served as chief executive officer of SBI's Osaka branch in Japan for four years, and earlier worked as an officer at SBI's Singapore office. In August 2020, he was appointed managing director and chief executive officer of SBI Funds Management. Prior to his appointment as managing director in November 2023, Tonse served as deputy managing director, overseeing corporate group accounts that cater to large corporate clients.

“There is only so much talent available, given the way the RBI regulates

compensation and other aspects of the banking sector. In that context, Vinay Tonse is a strong choice — he is highly experienced and brings deep operational understanding. In a private bank setup, with greater flexibility, he has the potential to do well, supported by a nuanced understanding of the Indian market,” said an industry insider, adding that it would be unfair to draw direct comparisons between Kumar and Tonse, as leadership outcomes are often person-dependent.

“This will be the first real test of Tonse's ability to lead a bank independently, but he has benefited from working under experienced leadership during his time at SBI. With SMBC likely to take a few years to assume larger ownership, the bank needs steady leadership in the interim — and Tonse fits that requirement,” he said.

According to Pratik Shah, partner and national leader — financial services at EY India, Tonse is a seasoned banker who has learnt from some of the best minds at SBI and understands the country at a grassroots level. “Having spent his entire career working within the construct of a PSU bank and still achieving market-leading growth, he now has the opportunity to operate in a relatively unconstrained private-sector setting, giving him the scope to take the bank further in its growth journey,” he said.

Yes Bank's loan growth has been in single digits for the last few quarters. In Q3FY26, the bank reported 5.2 per cent year-on-year growth in advances; in Q2FY26 it grew 6.5 per cent YoY; and in Q1FY26 advances recorded 8.2 per cent YoY growth.

The bank has chosen to fix its balance sheet first — focusing on asset quality and profitability rather than chasing scale — which has kept credit growth well below the system average. Retail lending, in particular, has remained subdued as the bank deliberately stepped away from low-yield, high-volume products such as home and car loans and shifted its focus to mid-yield segments. On the corporate side too, growth has been measured, with the bank focusing on mid-market corporates and small and medium enterprises (SMEs).

“Within retail and corporate and institutional banking (CIB) segments, we continue to remain selective and are strategically expanding our portfolio in those sub-segments that deliver the most attractive risk-adjusted returns,” Kumar had said during the Q3 earnings call with analysts.

With SMBC coming on board as a strategic investor with around a 25 per cent stake in the bank, it was largely expected that it would look for new management to drive the next phase of growth.

Among large shareholders, SMBC currently holds a 24.90 per cent stake in the bank. SBI holds nearly 11 per cent, Life Insurance Corporation of India (LIC) nearly 4 per cent.


<https://chanakyanipothi.com/>
<https://chanakyanipothi.com/grey-market-premium-latest-ipo-gmp/>
<https://chanakyanipothi.com/ipo-subscription-status/>
<https://chanakyanipothi.com/ipo-allotment-status-how-to-check/>
<https://chanakyanipothi.com/category/ipo-listing-estimates/>
<https://chanakyanipothi.com/upcoming-ipo-2025/>
<https://sahifund.com/>
1) <https://sahifund.com/whiteoak-capital-large-cap-fund/>
2) <https://sahifund.com/latest-new-fund-offers/>
3) <https://sahifund.com/dsp-multi-asset-allocation-fund/>
4) <https://sahifund.com/icici-prudential-flexicap-fund/>
5) Sahifund bottom
<https://chanakyanipothi.com/best-stock-to-buy-today/>
<https://chanakyanipothi.com/news-crx/>
<https://chanakyanipothi.com/fii-data-today/>
<https://sahifund.com/fii-dii-buy-sell-activity/>
<https://chanakyanipothi.com/chanakya-niti/>
<https://chanakyanipothi.com/stock-market-today-by-vaishali-parekh/>
<https://chanakyanipothi.com/technical-analysis-of-the-market-by-nagaraj-shetti/>
<https://chanakyanipothi.com/reliance-share-price-target-strategy-today/>
<https://chanakyanipothi.com/winning-strategy-for-gold-trading-tomorrow/>
<https://chanakyanipothi.com/rupee-dollar-exchange-rate-guidance/>
<https://chanakyanipothi.com/whatsapp-group/>

ધી બજાર ન્યુઝલાઇન

વર્ષ : ૩૨ અંક : ૧૩૨ તા.૫-૦૨-૨૦૨૬ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : પરેશ ગંજવાલા, સહ તંત્રી : રાધિકા ગંજવાલા

બજાર અતિશય વોલેટાઈલ

તામિલનાડ મર્કન્ટાઇલ બેંકનો રૂા. ૬૦૯લાળો શેર ધ્યાન ખેંચે છે



બજાર અતિશય વોલેટાઈલ હોવા છતાં પસંદગીના શેરોમાં તો સતત રિટર્ન છૂટી રહ્યું છે અને તેમાં **ઈન્ડિયન બેંક**નો શેર ખાસ ધ્યાન ખેંચે છે. રૂા. ૫૯૩ની બુકવેલ્યૂ સામે અત્યારે રૂા. ૯૧૨નો બજારભાવ ધરાવતા આ શેરમાં કેવળ ૧૦નો પીઈરેશિયો ચાલી રહ્યો છે અને કુલ મુડીરોકાણ ઉપર બેંકે ૬.૩૯ ટકાનું સુંદર રિટર્ન હાંસલ કર્યું છે. સને ૧૯૦૭માં સ્થપાયેલી અને અત્યારે ૧૧૮ વર્ષ પૂરા કરી ચુકેલી ઈન્ડિયન બેંકના રૂા. ૯૧૨વાળા શેરમાં આવતા થોડા દિવસો દરમ્યાન સુંદર ઉછાળા સાથે રૂા. ૯૨૩ અને તે પછીના

થોડા દિવસોમાં રૂા. ૯૩૫નો ભાવ જોવા મળે તેવી ગણતરી છે. છેક માર્ચ,૨૦૨૫થી રૂા. ૫૫૩ના ભાવે આ શેર ભેગા કરાવીએ છીએ અને અત્યાર સુધીમાં લગભગ તેમાં ૯૦ ટકા રિટર્ન તો છૂટી ગયું છે અને હજી પણ અત્યારના ભાવથી આ શેરમાં ઝડપથી ૫ ટકાના રિટર્નની જગ્યા છે.

આવો જ સુંદર ઉછાળો **યુનિયન બેંક**ના શેરમાં પણ ચાલે છે. અત્યારે યુનિયન બેંકનો શેર રૂા. ૧૭૨ની બુકવેલ્યૂથી સહેજ જ ઉપર છે અને કેવળ ૭.૨૯નો પીઈરેશિયો દર્શાવે છે. યુનિયન બેંક ઓગસ્ટ, ૨૦૨૫માં રૂા.

વધવાની જગ્યા છે. ગયા એક જ અઠવાડિયામાં આ શેરે ૩.૩૦ ટકાનું રિટર્ન પણ આપ્યું છે.

ચોથી મીડસાઈઝ બેંકમાં **તામિલનાડ મર્કન્ટાઇલ બેંક**નો રૂા. ૬૦૯લાળો શેર ખાસ ધ્યાન ખેંચે છે. દક્ષિણ ભારતની આ બેંકમાં પણ બુકવેલ્યૂ રૂા. ૫૯૬ છે અને તે રીતે બજારભાવ બુકવેલ્યૂ રેશિયો ૧:૧નો કહીઓ તો પણ સહેજય નવાઈ નહિ લાગે. અત્યારે ૭.૯૪ના પીઈરેશિયો ઉપર મળી રહ્યો છે અને તેમાં આગામી દિવસોમાં સુંદર ઉછાળાની જગ્યા છે. ટ્રેડિંગ વોલ્યૂમ પણ ઉછાળાનો મજબૂત સંકેત આપી જાય છે. સામાન્ય સંજોગોમાં આ કાઉન્ટર ઉપર ૩૪૧૧૮૨ શેરોનું વોલ્યૂમ થતું હતું તેન ેબદલે અત્યારે ૫૮૩૬૧૨ શેરોનું વોલ્યૂમ થવા લાગ્યું છે. છેલ્લા એક જ અઠવાડિયામાં આ શેરે ૧૦.૩૦ ટકાનું તોતિંગ રિટર્ન આપ્યું છે અને તે દરિએ થોડાક શેરો લઈને મૂકી દેજો. તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાં ઝડપી ઉછાળાને કારણે થોડીક ગરમી વધી છે



૧૨૪ ઉપર હતો ત્યારથી ભેગા કરાવીએ છીએ અને તે પછી રૂા. ૧૪૨ના ભાવે પણ આ શેર ૫૬૬વાનું કહ્યું હતું અને હવે જે રીતે આ શેરમાં રિસેમ્બર ક્વાર્ટરના પરિણામોનો સંપોર્ટ પણ મળ્યો છે અને એનપીએમાં ઘટાડો છે તે પાસું ધ્યાનમાં રાખીએ તો આ શેર અત્યારના રૂા. ૧૮૧-૧૮૨ના ભાવે પણ લઈને મૂકી દેજો અને તેમાં ઉપરમાં રૂા. ૧૮૭ અને તે પછીના થોડા દિવસોમાં રૂા. ૧૯૩નો ભાવ જોવા મળવાની ગણતરી છે.

આવો જ સુંદર ઉછાળો **ફેડરલ બેંક**ના શેરમાં પણ શરૂ થયો છે. દક્ષિણ ભારતમાં મજબૂત સ્થાન ધરાવતી આ બેંકની સ્થાપના છેક ૧૯૩૧માં થઈ હતી અને તે રીતે આવતા પાંચ વર્ષમાં ૧૦૦ વર્ષની ઉજવણી પણ કરશે. ફેડરલ બેંક અત્યારે ૧૬.૪૦ ટકાનો મજબૂત કેપિટલ એડિક્વસી રેશિયો ધરાવે છે. બુકવેલ્યૂ રૂા. ૧૪૭ છે અને બજારભાવ બુકવેલ્યૂ રેશિયો ૨નો ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં રૂા. ૨૮૯થી ઊંચકાઈને રૂા. ૨૯૨ અને તે પછીના થોડા દિવસોમાં રૂા. ૨૯૯નો ભાવ જોવા મળવાની સંભાવના છે અને સાથે સાથે આ કાઉન્ટર ઉપરનું ટ્રેડિંગ વોલ્યૂમ પણ હવે ઝડપથી

<https://staffavailable.com/>

Important Weblinks for Today

<https://chanakyanipothi.com/>
<https://chanakyanipothi.com/ipo-gmp/>
<https://chanakyanipothi.com/intraday-trading/>
<https://chanakyanipothi.com/grey-market-premium/>
<https://chanakyanipothi.com/ipo-subscription-status/>
<https://chanakyanipothi.com/ipo-allotment-status-how-to-check/>
<https://chanakyanipothi.com/category/ipo-listing-estimates/>
<https://chanakyanipothi.com/upcoming-ipos-2025/>
<https://sahifund.com/>
<https://sahifund.com/sip/>
1) <https://sahifund.com/whiteoak-capital-large-cap-fund/>
2) <https://sahifund.com/latest-new-fund-offers/>
3) <https://sahifund.com/dsp-multi-asset-allocation-fund/>
4) <https://sahifund.com/icici-prudential-flexicap-fund/>
5) <https://sahifund.com/best-stock-to-buy-today/>
<https://chanakyanipothi.com/news-crux/>
<https://chanakyanipothi.com/fii-data-today/>
<https://sahifund.com/fii-dii-buy-sell-activity/>
<https://chanakyanipothi.com/chanakya-niti/>
<https://chanakyanipothi.com/fujiyama-power-systems-ipo/>
<https://chanakyanipothi.com/tenneco-clean-air-ipo-date-price-gmp-review-details/>
<https://chanakyanipothi.com/physicswallah-ipo-date-review-price-allotment-details/>
<https://chanakyanipothi.com/emmvee-photovoltaic-ipo-date-review-price-allotment-details/>
<https://chanakyanipothi.com/pine-labs-ipo-date-review-price-allotment-details/>
<https://chanakyanipothi.com/sme-ipo-watch/workmates-core2cloud-ipo/>
<https://chanakyanipothi.com/sme-ipo-watch/mahamaya-lifesciences-ipo/>
<https://sahifund.com/canara-robeco-consumer-trends-fund/>
<https://chanakyanipothi.com/sme-ipo-watch/curis-lifesciences-ipo/>
<https://sahifund.com/groww-nifty-midcap-150-etf-growth/>
<https://sahifund.com/360-one-focused-fund/>
<https://sahifund.com/aditya-birla-sun-life-nifty-bank-etf/>
<https://chanakyanipothi.com/stock-market-today-by-vaishali-parekh/>
<https://chanakyanipothi.com/technical-analysis-of-the-market-by-nagaraj-shetti/>
<https://chanakyanipothi.com/reliance-share-price-target-strategy-today/>
<https://chanakyanipothi.com/winning-strategy-for-gold-trading-tomorrow/>
<https://chanakyanipothi.com/rupee-dollar-exchange-rate-guidance/>
<https://chanakyanipothi.com/chanakya-community/>

વધ્યું છે. આ કંપની એરોસ્પેસ માટે પણ ઈક્વીપમેન્ટ બનાવે છે. રૂા. ૨૪૩ની બુકવેલ્યૂ સામે રૂા. ૨૯૪રનો ભાવ ચાલે છે અને તે રીતે ૧૨.૧ ગણો બજારભાવ બુકવેલ્યૂ રેશિયો છે અને તે થોડુંક નકારાત્મક પાસું કહી શકાય. તેમ છતાં છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન તેના વેચાણો ૧૬.૫૦ ટકાના દરે વધ્યા છે. આગામી દિવસોમાં આ શેરમાં ઉપરમાં રૂા. ૨૭૪૧ અને તે પછી રૂા. ૩૧૦૦નો ભાવ જોવા મળવાની જગ્યા છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય.

ઘણા સમયથી ડંડો પડી રહેલો

મહિન્દ્રા લોજિસ્ટિક્સ અત્યારે રૂા. ૩૬૧ ઉપર આવ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રૂપની આ કંપનીએ પોતાના વાહનો પ્લાન્ટથી ઊલરના શોરૂમ સુધી લઈ જવા માટે કામકાજ શરૂ કર્યું હતું તે પછી સ્પેરપાર્ટની ડિલિવરીનું કામ શરૂ કર્યું હતું અને અત્યારે આ કંપની દેશની યોચની ઈકોમર્સ કંપનીઓ માટે સપ્લાયચેઈન ધરાવે છે. અત્યારે રૂા. ૩૬૧વાળા આ શેરમાં છેલ્લા એક જ અઠવાડિયામાં ૨૪.૨૫ ટકાનું તોતિંગ રિટર્ન જોવાયું છે અને છતાં પણ કોઈ પણ જાતના ઘટાડા વગર આ શેર તોફાની તેજી ચાલુ રાખે તેવી ગણતરી છે. રૂા. ૩૬૧વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં જ રૂા. ૩૭૨ અને તે પછી રૂા. ૩૮૩ અને તે પછીના ઉછાળે રૂા. ૪૧૩નો ભાવ જોવા મળવાની જગ્યા છે. નાનું રોકાણ કરી શકાય.

ટીડી પાવર સિસ્ટમ અત્યારે રૂા. ૭૩૦ ઉપર મળી રહ્યો છે અને આ કંપની દ્વારા એસી જનરેટર અને ઈલેક્ટ્રોનિક્સ મોટરનું ઉત્પાદન થાય છે. દેવાનો કોઈ બોજો નથી અને છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન તેનો નફો વાર્ષિક ૫૫.૬૦ ટકાના દરે ઊંચકાયો છે. આમ સુંદર કન્ટ્રામેન્ટલ ધરાવતી આ કંપનીમાં છેલ્લા એક જ અઠવાડિયામાં ૧૬.૮૫ ટકાનું સુંદર રિટર્ન છૂટ્યું છે. નોર્મલ સંજોગોમાં ૭૬૬૦૦૦ શેરોનું વોલ્યૂમ થતું હતું તેન ેબદલે અત્યારે ૫૦૪૫૦૦૦ શેરોનું વોલ્યૂમ થઈ રહ્યું છે એટલે કે લગભગ ૫.૭૫ ગણું વોલ્યૂમ વધી ગયું. આગામી દિવસોમાં ટીડી પાવર સિસ્ટમમાં રૂા. ૭૮૪ અને તે પછી રૂા. ૮૪૦ અને તે પછીના થોડા દિવસોમાં રૂા. ૯૬૫નો ભાવ જોવા મળવાની જગ્યા છે અને તેથી નાનું રોકાણ કરી દેવાય.

રૂા. ૬૮૬વાળા **હિન્ડુસ્તાન કોપર**માં પણ તોતિંગ ઉછાળો જ્યૂ છે. સોના અને ચાંદી પછી શોર્ટટર્મ ખેલાડીઓનું ફોકસ કોપર અને તે પછી એલ્યુમિનિયમ ઉપર શિફ્ટ થયું છે. કોપરમાં અત્યારે કોઈ ઈટીએફ કે ઈન્ફ્લેક્ડ ન હોવાથી કોપરની તેજનો લાભ લેવા માટે ખેલાડીઓએ હિન્દુસ્તાન કોપર ભેગા કરવાનું શરૂ કર્યું હતું અને તેને કારણે સપ્ટેમ્બર મહિનામાં રૂા. ૨૮૪ ઉપરનો આ શેર તાજેતરમાં રૂા. ૩૬૦ થઈને અત્યારે રૂા. ૬૮૬ ઉપર બંધ આવ્યો છે. શુક્રવારની એક જ સેશનમાં જે રીતે સોના અને ચાંદીમાં

કડાકો બોલાયો તે જ પ્રકારે હિન્દુસ્તાન કોપરના શેરમાં પણ ૯.૭૬ ટકા ઘટીને રૂા. ૬૮૬નો ભાવ આવ્યો છે અને આગામી દિવસોમાં હિન્દુસ્તાન કોપરમાં સુંદર ઉછાળા સાથે રૂા. ૭૨૫ અને તે પછી રૂા. ૭૬૩નો ભાવ જોવા મળવાની જગ્યા છે.

અશોક લેલેન્ડના શેરમાં પણ અત્યારે આકર્ષણ વધતું જાય છે. રૂા. ૧૯૭વાળા આ શેરમાં પણ આવતા થોડા દિવસો દરમ્યાન રૂા. ૨૦૦ અને તે પછીના થોડા દિવસોમાં રૂા. ૨૦૮નો ભાવ જોવા મળવાની જગ્યા છે અને તેથી તેમાં નાનું રોકાણ કરી શકાય. ફેબ્રુઆરી મહિનો શરૂ થતા જ હવે માર્ચ આખરના ટ્રક અને બસના ઓર્ડરો શરૂ થઈ ગયા છે અને હવે માર્ચ ક્વાર્ટરના ઓંકડા જોરદાર આવવાની ગણતરી છે અને તેથી અશોક લેલેન્ડમાં થોડુંક ફોકસ વધારાય.

રૂા. ૧૧૩ વાળા **ઈન્ડસ્વીફ્ટ લેબોરેટરીઝ**માં પણ અત્યારે જોરદાર આકર્ષણ છે. બુકવેલ્યૂ રૂા. ૧ ૬૦ છે અને તેની સરખામણીમાં ભાવ રિસ્કાઉન્ટમાં ચાલે છે. સને ૧૯૯૫માં સ્થપાયેલી આ કંપની બદ્લ ડ્રગ અને દવાઓનું ઉત્પાદન કરે છે અને સાથે સાથે વિશ્વના યોચના દેશોમાં એપીઆઈ પણ સપ્લાય કરે છે. શેર અત્યારે ૩૧ના પીઈરેશિયો ઉપર છે. અને તેના માથા ઉપર દેવાનો બોજો નથી. ગયા એક જ અઠવાડિયામાં આ શેરે ૩.૪૫ ટકાનું રિટર્ન આપ્યું છે અને ઉછાળાની સંભાવના જોતા મોટા પાયે માલ ક્વર થવાનું શરૂ થતા ટ્રેડિંગ વોલ્યૂમ પણ સરેરાશ કરતા ડબલ થઈ ગયું છે. છેલ્લા ક્વાર્ટરમાં વેચાણો અને નફામાં તોતિંગ ઉછાળો જોવાયો. અને આ પાસાને કારણે રૂા. ૧૧૩ વાળો શેર આવતા થોડા દિવસોમાં રૂા. ૧૧૮ અને તે પછી રૂા. ૧૨૩ અને તે પછીના થોડા દિવસોમાં રૂા. ૧૩૪નો ભાવ બતાવશે તેવી ગણતરી છે.

એમઆરપીએલના શેરમાં પણ અત્યારે જોરદાર આકર્ષણ છે. આ કંપની રિફાઈનીંગનું કામ કરે છે અને ઓતરરાષ્ટ્રીય બજારમાં કૂડમાં મજબૂતી આવવાને કારણે ઓએનજીસી ઉપરાંત એમઆરપીએલ અને અન્ય રિફાઈનીંગ શેરોમાં આકર્ષણ વધ્યું છે. રૂા. ૧૭૭વાળા આ શેરમાં આવતા થોડા દિવસોમાં રૂા. ૧૮૧ અને તે પછી રૂા. ૧૮૬નો ભાવ જોવા મળવાની જગ્યા છે.

બજાજ કન્સ્યુમર કેર અત્યારે રૂા. ૩૩૯ ઉપર છે. હજી એફએમસીજી શેરોમાં ગામશાહી લેવાલી શરૂ નથી થઈ, પરંતુ રૂા. ૩૩૯વાળા બજાજ કન્સ્યુમરના શેરમાં કેન્સી વધતી જાય છે અને આવતા થોડા દિવસોમાં જ આ શેરમાં ઉપરમાં રૂા. ૩૫૦ અને તે પછી રૂા. ૩૬૦ અને તે પછીના થોડા દિવસોમાં રૂા. ૩૮૦નો ભાવ જોવા મળવાની જગ્યા છે. ગયા એક જ અઠવાડિયામાં આ શેરે ૧૦.૯૯ ટકાનું તોતિંગ રિટર્ન આપ્યું છે. અને તેથી આ

શેર ઉપર ફોકસ રાખી શકાય. રૂા. ૮૧૮વાળા **વિનસ એડીઝ**માં પણ અત્યારે સુંદર આકર્ષણ છે અનેતેમાં પણ આવતા થોડા દિવસોમાં રૂા. ૮૩૨ અને તે પછી રૂા. ૮૪૨નો ભાવ જોવા મળવાની જગ્યા. આ શેરે ગયા અઠવાડિયા દરમ્યાન ૧૪.૭૯ ટકાનું તોતિંગ રિટર્ન આપ્યું છે અને ટ્રેડિંગ વોલ્યૂમ પણ ત્રણ ગણું થઈ ગયું છે. નોર્મલ સંજોગોમાં આ કાઉન્ટર ઉપર ૩૦૦૦૦ શેરોનું વોલ્યૂમ થતું હતું તેને બદલે અત્યારે ૯૦૦૦૦ શેરોનું વોલ્યૂમ થવા લાગ્યું છે. અન્ય ફાર્મા કંપનીઓની સરખામણીમાં વેચાણો અને નફાશક્તિ ખૂબ નાના છે તેમ છતાં રૂા. ૮૧૮ના ભાવે નાનું રોકાણ કરી શકાય અને તેમાં આવતા થોડા દિવસો દરમ્યાન સુંદર ઉછાળા સાથે રૂા. ૮૩૨ અને તે પછી ધીરે ધીરે રૂા. ૮૮૮નો ભાવ જોવા મળે તેવી ગણતરી છે.

એબીબીનો શેર પણ ખાસ ધ્યાન ખેંચે છે. અત્યારે રૂા. ૫૫.૭૮ વાળા આ શેરમાં બુકવેલ્યૂની સરખામણીમાં ભાવ મોંઘો છે, પરંતુ દેવાનો નહિવત બોજો ધરાવતી આ કંપનીમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન નફો ૪૦ ટકાના દરે વધતો આવ્યો છે. આ ઉપરાંત ટ્રેડિંગ વોલ્યૂમ પણ નોર્મલ કરતા ડબલ થઈ ગયું છે અને છેલ્લા એક જ અઠવાડિયામાં આ શેરે ૧૮.૮૩ ટકાનું સુંદર રિટર્ન આપ્યું. એબીબીમાં ભાવ ઝડપથી ઉછળ્યો હોવાથી બાય ઓન ડીપ એટલે કે થોડોક ઘટે તે પછી એન્ટ્રી લઈ લેવી અને તેમાં ઉપરમાં રૂા. ૫૬૫૬ અને તે પછી રૂા. ૭૫૫૭નો ભાવ જોવા મળવાની જગ્યા છે.

સિમેન્ટ શેરોમાં દક્ષિણ ભારતની **ધ રામકો સિમેન્ટ**માં અત્યારે લેવાલી વધી છે. રૂા. ૧૧૨૧વાળા આ શેરમાં આવતા થોડા દિવસો દરમ્યાન રૂા. ૧૧૪૦ અને તે પછીના થોડા દિવસોમાં રૂા. ૧૧૮૧નો ભાવ જોવા મળવાની જગ્યા છે અને તે રીતે નાનું રોકાણ કરી શકાય.

રૂા. ૧૩૫ ઉપરના **લોટસ આઈ હોસ્પિટલ**ના શેરમાં પણ આકર્ષણ વધતું જાય છે. એમ પણ છેલ્લેકર, હોસ્પિટલ અને ડાયગ્નોસ્ટિક શેરોમાં ફેન્સી છે. અને આ પાસાને ધ્યાનમાં રાખીએ તો રૂા. ૧૫૨ અને તે પછી રૂા. ૧૬૫ના ભાવની સંભાવના મજબૂત.

એસઈ ઈન્ડસ્ટ્રીઝના રૂા. ૧૦૦૨વાળા શેરમાં પણ અત્યારે આકર્ષણ વધ્યુ છે. સને ૨૦૧૩માં સ્થપાયેલી આ કંપની સ્પેશ્યાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરે છે અને અમુક પ્રકારના કેમિકલ્સમાં તો ભારતમાં આ એક જ કંપનીનું ઉત્પાદન છે. દેવાનો કોઈ જ બોજો નથી અને ટ્રેડિંગ વોલ્યૂમ પણ ઉછાળાનો સંકેત આપે છે. આગામી દિવસોમાં એશ્વર ઈન્સ્ટ્રીઝના શેરમાં મજબૂત વૃદ્ધિ સાથે રૂા. ૧૦૩૮ અને તે પછી ઓંકડાની અદલા બદલી કરીને રૂા. ૧૦૮૩નો ભાવ જોવા મળવાની જગ્યા છે અને તેથી થોડાક શેરો લઈને મૂકી શકાય.

રૂા. ૩૦૧ ઉપરના **કરૂર ચૈચય**

Yash Innoventures Limited									
(CIN: L45100GJ1991PLC016557)									
(Formerly known as Redex Protech Limited)									
Registered Office: 1 Floor, Corporate House No.3, Parshwanath Business Park, Behind Prahladnagar Garden, S G Highway, Ahmedabad-380014, Gujarat, India.									
EXTRACT FROM THE STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31.12.2025									
(Rupees in Lacs)									
Sr. No.	Particulars	Quarter ended 31-12-2025	Quarter ended 30-09-2025	Quarter ended 31-12-2024	Nine Months ended		Year ended		
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1	Total income from operations	10.62	40.64	-17.32	149.97	44.51	49.12		
2	Net Profit / (Loss) for the period before Tax, Exceptional and/or Extraordinary items)	-39.97	-173.94	-71.71	-250.20	-169.49	-316.50		
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	-39.97	-173.94	-71.71	361.90	-169.49	-316.50		
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	-45.32	-215.50	-75.80	263.59	-190.76	-446.21		
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	-45.32	106.63	-75.80	585.72	-190.76	-446.21		
6	Equity Share Capital	1603.00	1603.00	1603.00	1603.00	1603.00	1603.00		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	402.82	402.82	402.82	402.82	402.82	402.82		
8	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)	-0.28	0.67	-0.47	3.65	-1.19	-2.78		
	Basic : Diluted :	-0.28	0.67	-0.47	3.65	-1.19	-2.78		

Notes: 1.The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com).

2.The result of the Quarter ended on 31st December, 2025 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 04/02/2026.



BY ORDER OF THE BOARD OF DIRECTORS,
For Yash Innoventures Limited
SD/-
Gnanesw Bhagat
Managing Director
DIN - 00115076

Place: Ahmedabad

Date: 04/02/2026

મ્યુચ્યુઅલ ફંડ એનાલિસીસ અને મ્યુચ્યુઅલ ફંડના પ્રશ્ન માટે <https://sahifund.com/>